

અગત્યનુ

ધોરણ-૧૧ (વિ.પ.) પ્રવેશ

ક્રમાંક: મઉમશબ/સંશોધન/૨૦૨૪/૧૫૬૩-૭

ગુજરાત માધ્યમિક અને

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,

સેક્ટર-૧૦ બી, જૂના સચિવાલય પાસે,

ગાંધીનગર, તા. ૦૬/૦૫/૨૦૨૪

729

પ્રતિ,

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ

ગુજરાત રાજ્ય.

વિષય:- શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ માં ધોરણ-૧૧ (વિજાન પ્રવાહ)માં પ્રવેશ અંગે.

સંદર્ભ :- અત્રેની કચેરીનો પત્રકમાંક: મઉમશબ/સંશોધન/૨૦૧૬/૨૨૦૦-૩૬, તા. ૧૬/૦૫/૨૦૧૬

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરીના સંદર્ભ દર્શિત પત્રથી ધોરણ-૧૧ (વિજાન પ્રવાહ)માં પ્રવેશ આપવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫માં ધોરણ-૧૧ (વિજાન પ્રવાહ)માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ઉક્ત સંદર્ભ દર્શિત પત્રથી આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. તા. ૧૬/૦૫/૨૦૧૬ના અત્રેનાં પત્રની નકલ આ સાથે સામેલ છે.

આ ઉપરાંત, શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ થી ધોરણ-૧૧ (વિજાન પ્રવાહ)માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે શિક્ષણ વિભાગના તા. ૦૨/૧૨/૨૦૨૧ના ઠરાવ ક્રમાંક: મશબ/૧૧૧૬/૮૫૭/૪ થી જણાવ્યા મુજબ નીચેની બાબત દ્વારા લેવાની રહેશે.

- જે વિદ્યાર્થીએ ધોરણ-૧૦ ગણિત બેઝિક સાથે પાસ કરેલ હોય તે ધોરણ-૧૧ માં વિજાન પ્રવાહમાં "B" ગૃપમાં પ્રવેશ મેળવી શક્યો પરંતુ "A" અથવા "AB" ગૃપમાં પ્રવેશ મેળવી શક્યો નથી.
- ધોરણ-૧૦ માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ-૧૧ વિજાન પ્રવાહમાં "A" અથવા "AB" ગૃપમાં પ્રવેશ મેળવવા મંગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમ્યાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ-૧૧ વિજાન પ્રવાહમાં "A" અથવા "AB" ગૃપમાં પ્રવેશ મેળવી શક્યો.

આ ઉપરાંત, CBSE બોર્ડમાં જે વિદ્યાર્થીએ ધોરણ-૧૦માં Mathematic Basic સાથે પાસ કરેલ હોય તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં ધોરણ-૧૧ વિજાનપ્રવાહમાં "B" ગૃપમાં પ્રવેશ મેળવી શક્યો. પરંતુ "A" અથવા "AB" ગૃપમાં પ્રવેશ મેળવી શક્યો નથી.

ઉપરોક્ત વિગતો દ્વારા લઈને શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ માં ધોરણ-૧૧ (વિજાન પ્રવાહ)માં પ્રવેશ અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે આપના તાબાની તમામ ઉચ્ચતર માધ્યમિક (વિજાન પ્રવાહ) શાળાઓને સૂચના આપશો.

2024  
5. માન્યતા  
ધરાવતી  
શાળા

સંયુક્ત નિયામક

ગુજરાત માધ્યમિક અને

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

ગાંધીનગર

બિડાયા :- ઉપર મુજબ.

## જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ શહેર

બ્લોક-એ, પ્રથમ માટ, બહુમાળી ભવન, સરકારી વસાહત રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦૦૫૨

ક્રમાંક: જિશિઅપરસ્ય/૨૦૨૪/ ૧૩૮૮


પ્રતિ,

માધ્યમિક/માન્યતા/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ

સરકારી/ગ્રાન્ડેડ/નોન ગ્રાન્ડેડ,

અમદાવાદ શહેર.

ઉપરોક્ત પરિપત્ર વંચાણે લઇ ચુસ્તપણે અમલ કરવા સાટું.

  
જિલ્લા શિક્ષણાધિકારી  
અમદાવાદ શહેર

નકલ રવાના જાણ તથા અમલ સાટું

-શિક્ષણ નિરીક્ષકશ્રી/મદ્દનિશ શિક્ષણ નિરીક્ષકશ્રી, વહીવટી કર્મચારીશ્રી તમામ સદર કચેરી.

અગત્યાનુ

ક્રમાંક:- મઉમશબ/સંશોધન/૨૦૧૯/૨૨૦૦  
ગુજરાત માધ્યમિક અને  
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,  
સેક્ટર-૧૦ બી, જીના સચિવાલય પાસે,  
ગાંધીનગર, તા. ૧૬/૦૫/૨૦૧૯

પ્રતિ,

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, (તમામ)

ગુજરાત રાજ્ય.

વિષય:- ઉચ્ચતર માધ્યમિક ધોરણ-૧૧ (વિજ્ઞાન પ્રવાહ)માં શૈક્ષણિક સત્ર જુન-૨૦૧૯  
થી પ્રવેશ અંગે.

- સંદર્ભ:-
- શિક્ષણ વિભાગના હરાવ ક્રમાંક: ઉમશ-૧૧૮૭-૧૨૦૩-ગ-૧. તા. ૧૦/૦૫/૨૦૧૯.
  - શિક્ષણ વિભાગના હરાવ ક્રમાંક: મશબ-૨૦૦૦-૧૦૪૬-૭. તા. ૩૦/૦૪/૨૦૦૦.
  - ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પત્ર ક્રમાંક:-  
મઉમશબ/સંશોધન/બફટી/૨૬૨૫૦ તા. ૨૪/૦૪/૨૦૦૪
  - શિક્ષણ વિભાગના હરાવ ક્રમાંક: પરચ/૧૦૨૦૧૯/૧૨૬/૨ તા. ૦૮/૦૩/૨૦૧૯.
  - સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હરાવ ક્રમાંક: EWS/૧૨૨૦૧૯/૪૫૦૩/A  
તા. ૨૩/૦૧/૨૦૧૯

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર  
માધ્યમિક શિક્ષણ બોર્ડના તા. ૨૪/૦૪/૨૦૦૪ના પત્રથી રાજ્યની સરકારી તેમજ સહાયક  
અનુદાન મેળવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૧૧ વિજ્ઞાનપ્રવાહમાં વિદ્યાર્થીઓને  
પ્રવેશ આપવા અંગે શાળાઓને અનુસરવાની કાર્યવાહી અંગેના નિયમો મુકરર કરવા બાબતે  
જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા. ૨૩/૦૧/૨૦૧૯ના હરાવની  
જોગવાઈ મુજબ હાલની સૂચનાઓમાં ફેરફાર કરી નીચે દર્શાવ્યા મુજબ સૂચનાઓ આપવામાં  
આવે છે.

ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના પ્રવેશ માટેની યાદી તૈયાર કરતી વખતે ત્રણ મુખ્ય  
વિષયો [ગાણિત, વિજ્ઞાન અને અંગેજુ (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા)] માં મેળવેલ ગુણને  
ધ્યાનમાં લઈ પ્રવેશ યાદી (મેરીટ યાદી) બનાવવી. તેમજ નીચે દર્શાવ્યા પ્રમાણે  
જગ્યાઓની બેઠકનું વર્ગીકરણ કરવાનું રહેશે.

ક્રમ	જગ્યાની વિગત	બેઠકની સંખ્યા
૧	- અનુસૂચિત જાતિ (૭%)	૦૪
૨	- અનુસૂચિત જનજાતિ (૧૫%)	૧૧
૩	- સામાજિક અને શૈક્ષણિક રીતે પણત વર્ગો (૨૭%)	૨૦
૪	- આધ્યક રીતે નબળા વર્ગો (EWS) (૧૦%)	૦૮

૫	- પોતાની શાળા	૧૫
૬	- અન્ય શાળાના (જે શાળામાં ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહ ન હોય તેવી શાળાના ધો-૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે)	૦૫
	કુલ	૭૫

ઉક્ત જોગવાઇ ફક્ત ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના પ્રવેશ માટે જ લાગુ પાડવાની  
રહેશે.

૧૬  
(ડા.એસ.પટેલ)

સચિવ  
ગુજરાત માધ્યમિક અને  
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,  
ગાંધીનગર

નકલ સંવિનય રવાના:-

- માન.અધ્યક્ષશ્રી, ગુ.મા.. અને ઉ.મા.શિ. બોર્ડ, ગાંધીનગર.
- ખાસ ફરજપરના અધિકારીશ્રી, ગુ.મા. અને ઉ.મા.શિ. બોર્ડ, ગાંધીનગર.
- નાયબ નિયામક (પરીક્ષા), (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ)